

3<sup>rd</sup> July, 2024

**To,**

**BSE Ltd.**

Listing Dept. / Dept. of Corporate Services  
Phiroze Jeejeebhoy Towers  
Dalal Street  
Mumbai - 400 001

**Security Code : 500 101**

**Security ID : ARVIND**

**To,**

**National Stock Exchange of India Ltd.**

Listing Dept., Exchange Plaza, 5<sup>th</sup> Floor  
Plot No. C/1, G. Block  
Bandra-Kurla Complex  
Bandra (E)  
Mumbai - 400 051

**Symbol : ARVIND**

Dear Sir/Madam,

**Sub: Submission of newspaper advertisement.**

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the copies of the newspaper advertisement published on 3<sup>rd</sup> July, 2024 in the Financial Express (English & Gujarati) informing the shareholders for updating their email addresses in the records of the Company/ Depositories in compliance with the General Circular No. 09/2023 dated 25<sup>th</sup> September, 2023 issued by the Ministry of Corporate Affairs (MCA).

Kindly take the same on your records.

Thanking You

Yours faithfully,

**For, Arvind Limited**

**Krunal Bhatt**

**Company Secretary**

Encl.: As above



## ● RUNOFF ELECTION THIS WEEKEND

# French candidates quit to block far right

SUPOI KAR-GUPTA &  
DOMINIQUE VIDALON  
Paris, July 2

**OPPONENTS OF FRANCE'S** National Rally (RN) stepped up their bid to block the far-right party from power on Tuesday as more candidates said they would bow out of this week-end's run-off election to avoid splitting the anti-RN vote.

Over 200 candidates have confirmed they will not stand in Sunday's second-round for France's 577-seat national parliament, according to local media estimates. Others have until 6pm (1600 GMT) to make their choice.

Marine Le Pen's RN came out well ahead in Sunday's first-round vote after President Emmanuel Macron's gamble on a snap election backfired, leaving his centrist camp in a hostly formed left-wing alliance.

But even before the manoeuvring of the last 24 hours to create a "republican front" to block the anti-immigrant, eurosceptic party, it was far from clear the RN could win the 289 seats needed for a majority. Pollsters calculated the first round put the RN on track for a third round with 250-300 seats. But that was before the tactical withdrawals and cross-party calls for voters to back whichever candidate was best placed to defeat the local RN rival.

"The match is not over," the Socialist mayor of Paris, Anne



French Prime Minister Gabriel Attal (left), campaigns with local candidate for the second round of the legislative election Stanislas Guerin, (centre) on Tuesday in Paris.

## Le Pen seeks broad support to win parliamentary majority

MARINE LE PEN is seeking support from beyond her far-right National Rally party that would allow her to govern even if she falls short of an absolute majority in Sunday's legislative election.

"If we're just a few members of parliament away from a majority, we'll try to find them," Le Pen told France Inter radio Tuesday. "We're

going to go and see the others, and we're going to say to them: 'Are you ready to join us in a new majority?'"

National Rally and its allies dominated the first round of voting two days ago, getting 33.2% of the vote. The left-wing New Popular Front alliance got 28%, while Macron's coalition won 20.8%. —BLOOMBERG

Hidalgo, told France 2. "We must mobilise all our forces." Markets gained on Monday on relief that the far right had not performed better, but the

reaction has been muted by the fact that a hung parliament would also risk policy paralysis for the rest of Macron's presidency till 2027. —REUTERS

## Tesla's deliveries decline 5%

TESLA ON TUESDAY reported a smaller-than-expected 5% drop in vehicle deliveries in the second quarter, as the electric vehicle maker's price cuts and incentives helped stimulate demand. Shares of the world's most valuable automaker rallied more than 10% on Tuesday, hitting the highest level in over five months.

The EV maker handed over 443,936 vehicles in the three months to June 30, 4.8% lower than a year earlier and up 14.8% from the preceding quarter. —REUTERS



### NOTICE OF 50TH ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the 50th Annual General Meeting (AGM) of the members of Sundaram Brake Linings Limited (the Company) will be held on **Wednesday, 24th July 2024 at 10.00 A.M.** through Video conference (VC) / Other Audio Visual Means (OAVM) to transact the ordinary and special businesses as set out in the Notice of AGM, in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("Act"). Pursuant to the General Circular No. 09/2023 dated September 25, 2023, issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular SEBI/HO/CFD/CMD2/CIR/P/2023/167 dated October 7, 2023, issued by SEBI (hereafter collectively referred to as "the Circulars"), permitted the holding of the AGM through VC / OAVM, without the physical presence of the Members at a common venue.

In Compliance with the above circulars, electronic copy of Annual Report along with the Notice of AGM for the financial year 2023-24 will be sent only to the shareholders whose email addresses are registered with the Company Depository Participant(s). These documents are available and can be downloaded from the Company's website <https://www.bseindia.com/images/assets/pdf/SEBI/Annual%20Report%20-%202024.pdf>, website of the Stock Exchanges (i.e. National Stock Exchange of India Limited and BSE Limited) and [www.bseindia.com](http://www.bseindia.com) respectively and on the website of NSDL [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com).

#### Manner of casting vote(s) through e-voting:

The Members are provided with the facility to cast their votes on all resolutions set forth in the Notice of the AGM through Remote e-voting or e-voting system at the AGM provided by NSDL.

All the members are informed that:

- The cut-off date to determine the eligibility to vote by electronic means or at the AGM is **Wednesday, 17th July, 2024**.
- Remote e-voting shall commence on **Sunday, 21st July, 2024 at 9:00 A.M.** and shall end on **Tuesday, 23rd July, 2024 at 5:00 P.M.** after which e-voting platform shall be disabled by NSDL.
- Members who shall have their share in the AGM through VC/OAVM facility and have not cast their vote on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.
- Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend/ participate in the AGM through VC / OAVM but shall not be entitled to cast their vote again.
- Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company, and holds shares as of the cut-off date, may obtain the login ID and password by sending a request to [evoting@nsdl.co.in](mailto:evoting@nsdl.co.in). However, if he/she is already registered with NSDL for remote e-voting then he/she can use his/her existing User ID and password for casting their votes.

#### Manner of registering/updating e-mail address:

If you have not registered your email address with the Company/Depository you may please follow the below instructions for obtaining the login details for e-voting.

- In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, Bank details, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) for registering email address by sending a request to the RTA at [kalyan@integrated.co.in](mailto:kalyan@integrated.co.in)
- In case shares are held in demat mode, please contact the Depository Participant (DP) and register your e-mail address at your demat account, as per the process advised by your DP.
- Please keep your updated email ID registered with the Company / Depository Participant to receive timely communication.

#### Joining the AGM through VC/OAVM:

The Members will be provided with a facility to attend the AGM through VC/OAVM through the NSDL e-voting system. The detailed instructions and steps to be followed for attending the AGM are explained in the Notice of the AGM.

The Company has appointed Mr. V. Suresh (Partner, V. Suresh Associates, Practising Company Secretaries) as the Scrutinizer to scrutinize both the Remote e-voting process and e-voting at the AGM in a fair and transparent manner.

Pursuant to Section 91 of the Companies Act, 2013, and all other applicable Laws, the Register of Members and Share Transfer books of the company shall remain closed from **Thursday, 16th July, 2024 to Wednesday, 24th July, 2024** (both days inclusive) for the purpose of 50th AGM.

In case of any queries or grievances relating to electronic voting, Members may refer to the "Frequently Asked Questions" (FAQs) and e-voting User Manual for members available at the "Downloads" Section of NSDL's e-voting website: [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com) or call on 022-4886 7000 and 022-4886 7000 or send request to Ms. Pratiksha Pawar at [evoting@nsdl.co.in](mailto:evoting@nsdl.co.in) or contact Ms. Pratiksha Pawar, Assistant Manager, NSDL, Trade Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Panel, Mumbai-400013 at the designated e-mail IDs: [evoting@nsdl.co.in](mailto:evoting@nsdl.co.in)

For Sundaram Brake Linings Limited  
Place : Chennai  
Date : 03/07/2024  
Sd/-  
J.R. Vishnu Varthan  
Company Secretary

**BAYER CROPSCIENCE LIMITED**  
CIN: L24210MH1958PLC011173



**Regd. Office:** Bayer House, Central Avenue,  
Hiranandani Estate, Thane (West) - 400607.  
**Tel. No.:** 022-2531 1234; **Fax No.:** 022-2545 5063  
**Website:** [www.bayer.in](http://www.bayer.in); **Email:** [ir\\_bcs@bayer.com](mailto:ir_bcs@bayer.com)

### INFORMATION REGARDING 66<sup>th</sup> ANNUAL GENERAL MEETING TO BE HELD VIA VIDEO CONFERENCING ("VC") / OTHER AUDIO-VISUAL MEANS ("OAVM"), RECORD DATE AND FINAL DIVIDEND INFORMATION

- Shareholders may note that the 66th Annual General Meeting ("AGM") of the Company will be held through VC/OAVM on **Wednesday, August 14, 2024 at 11:30 am IST** in compliance with the circulars issued by the Ministry of Corporate Affairs, Government of India ("MCA") vide its Circular No. 14/2020 dated April 08, 2020, Circular No. 17/2020 dated April 13, 2020, Circular No. 20/2020 dated May 05, 2020 and Circular No. 02/2021 dated January 13, 2021, Circular No. 19/2021 dated December 08, 2021, Circular No. 21/2021 dated December 14, 2021, Circular No. 22/2022 dated May 05, 2022, Circular No. 10/2022 dated December 28, 2022 and Circular No. 09/2023 dated September 25, 2023, Securities and Exchange Board of India ("SEBI") vide its Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022, Circular No. SEBI/HO/CFD/PD-2/CIR/2023/4 dated January 05, 2023, SEBI/HO/CFD/PD-2/CIR/2023/167 dated October 07, 2023 and all other applicable laws and circulars issued in this regard.
- In compliance with the above circulars, electronic copies of the Notice of the 66<sup>th</sup> AGM and Annual Report for Financial Year 2023-24 will be sent to all the Shareholders whose email addresses are registered with the Company/Depository Participant ("DP"). Shareholders holding shares in dematerialized mode, are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their DP for permanently registering their email address with the Company/DP.
- Shareholders may also note that the Notice of the 66<sup>th</sup> AGM and Annual Report for the Financial Year 2023-24 will also be made available on the Company's website at [www.bayer.in](http://www.bayer.in), BSE Limited website and on the NSDL's website at [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com) in due course. The physical copies of the Notice of the 66<sup>th</sup> AGM along with Annual Report for the Financial Year 2023-24 shall be sent to those Members who request for the same.
- The Company has made special arrangements with the Company's Registrar and Share Transfer Agent, Link Intime India Private Limited ("LIPL"), (formerly TSR Consultants Private Limited which got merged with LIPL) for registration of e-mail addresses of those Members (holding shares either in electronic or physical form) who wish to receive the Notice of the AGM electronically and cast votes electronically. Eligible members whose email addresses are not registered with the Company/DP are required to provide the same to LIPL on or before 05:00 p.m. IST, Wednesday, August 07, 2024. The link for registering email id is given herein:  
Visit the link: [https://linkweb.linkintime.co.in/EmailReg/Email\\_Register.html](https://linkweb.linkintime.co.in/EmailReg/Email_Register.html)

- Members holding shares in physical form and who are yet to register/update their bank account details for electronic receipt of dividend amount directly into their bank accounts, are requested to get the same registered with the Company by submitting the requisite documents as mentioned in the Notice convening the AGM to [cs-unit@linkintime.co.in](mailto:cs-unit@linkintime.co.in) Members holding shares in electronic form are requested to get their bank account details registered/updated with their respective DPs.
- Shareholders will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of the AGM through electronic voting system. The manner of voting remotely for Shareholders holding shares in dematerialized mode, physical mode and for Shareholders who have not registered their email addresses will be provided in the Notice to the Shareholders. The details will also be made available on the website of the Company. Shareholders are requested to visit [www.bayer.in](http://www.bayer.in) to obtain such details.
- Shareholders may note that the Board of Directors at their meeting held on May 23, 2024, has recommended a Final Dividend of ₹ 35.00 per Equity Share, Pursuant to Section 91 of the Companies Act, 2013, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Friday, August 02, 2024, till Friday, August 09, 2024 (both days inclusive) for the purpose of AGM and payment of Final Dividend on the Equity Shares of the Company for the Financial Year ended March 31, 2024. The Final Dividend, if declared at the AGM will be paid on or after Wednesday, August 28, 2024 to those Members whose name appears on the Company's Register of Members as holders of Equity Shares on Thursday, August 01, 2024, and in respect of shares held in dematerialized form, to the Beneficial Owners of the Equity Shares as at the end of the day on the same date as per the details furnished by the Depositories for the purpose.
- Shareholders may note that the Final Dividend will be paid electronically to those shareholders who have updated their bank account details. SEBI vide its circular dated November 03, 2021 (subsequently amended) by circulars dated December 14, 2021, March 16, 2022, and November 17, 2023) has mandated that with effect from April 01, 2024, dividend to Shareholders holding shares in physical form shall be paid only through electronic mode. Such payment shall be made only if the folio is KYC compliant i.e. the details of PAN, Choice of Nomination, Contact Details, Mobile Number, Complete Bank Details and Specimen Signatures are registered. In case of non-updation of PAN or Choice of Nomination or Contact Details or Mobile Number or Bank Account Details or Specimen Signature in respect of physical folios, dividend / interest etc. shall be paid upon furnishing all the aforesaid details in entirety.
- Shareholders may note that pursuant to Finance Act, 2020, dividend income will be taxable in the hands of the Shareholders w.e.f. April 01, 2020, and the Company is required to deduct tax at source ("TDS") from dividends paid to Shareholders at the prescribed rates (plus applicable surcharge and cess) as may be notified from time to time. The information regarding the applicability of TDS rate for various categories of Shareholders and documentation required, is available under the Investor Section at [www.bayer.in](http://www.bayer.in). Shareholders are requested to send all the necessary documents complete in all respect through email at [dividend.india@bayer.com](mailto:dividend.india@bayer.com) on or before Thursday, August 01, 2024, to enable the Company to deduct the correct TDS on the dividend payment.
- The 66<sup>th</sup> AGM Notice will be sent to the Shareholders in accordance with the applicable laws at their registered email addresses in due course.

For Bayer CropScience Limited  
Sd/-  
Simon-Thorsten Wiebusch  
Vice Chairman & Managing  
Director and CEO  
(DIN: 08335591)

Place : Thane  
Date : July 03, 2024

**PTC India Financial Services Limited**

PTF is a systemically important, RBI regulated NBFC, classified as an Infrastructure Finance Company, a subsidiary of PTC India Ltd., listed on NSE & BSE. It is the leader in providing financing solutions to power projects across the energy value chain.

**DIRECTOR - FINANCE & CFO**

PTF invites applications from senior leaders to lead the organization to deliver sustainable growth, working in tandem with the Governing Board:

**Required experience:**

- Minimum 20 years of experience in Group A service of State/Central Govt. or corporate experience of which minimum 6 years should be in Banking/Financial Services/Power/Related Infra Organizations.
- Proven leadership experience (Board level) level below Board, except Group A service of State/ Central Govt./or having minimum of 3 years' experience in positions two level below the Board, except Group A service of State/ Central Govt.
- Domain knowledge of Resource mobilization, Corporate Financial Management, IND-AS regulations etc. with an understanding of RBI guidelines and Banking operations. Prior experience of mobilization of resources from environmental, social and governance (ESG) focused investors will be added advantage.
- Strong commercial and business acumen, stakeholder management and networking skills.
- Strong appreciation for risk & compliance.

**Age as on 30th June, 2024:** Between 45 years to 57 years.

**Education:** CA, ICWA, MBA Finance, CFA or equivalent

**Location:** Delhi, India

**Tenure:** 5 years or up to the date of superannuation, whichever is earlier. No deputation/lien will be allowed.

**Total Compensation:** upto INR 1 Crore including variable pay and other benefits.

For further details including Job Description please visit career page at: <https://www.ptcfinancial.com>

Interested candidates may send their CVs via email to: [recruitment-@ptcfinancial.com](mailto:recruitment-@ptcfinancial.com)

All applications will be held in strict confidence and should be received by 6:00 pm IST on July 24, 2024

(CIN: L65999DL2006PLC153373)

**Registered Office:** 7th Floor, Telephone Exchange Building, 8 Bhikaji Cama Place, New Delhi - 110 066  
**Board:** +91 11 26737300 Fax: 26737373, Website: [ptcfinancial.com](http://ptcfinancial.com)

**WORLD FOOD INDIA 2024** 19-22 September  
Processing for Prosperity  
BHARAT MANDAPAM, NEW DELHI

A MINISTRY OF FOOD PROCESSING INDUSTRIES, GOVERNMENT OF INDIA INITIATIVE

**SHOWCASE, CONNECT & COLLABORATE**

POLICY ROUNDTABLES	EXHIBITIONS	B2B, B2G, G2G MEETINGS & RBSM
THEMATIC SESSIONS	FOOD STREET	FS&I GLOBAL FOOD REGULATORS SUMMIT

19-22 Sept 2024 | Bharat Mandapam, New Delhi

[www.worldfoodindia.gov.in](http://www.worldfoodindia.gov.in)

BOOK YOUR SPACE NOW

**CENTRAL RAILWAY**  
MUMBAI DIVISION

**PROCUREMENT OF MATERIAL**

Tender Notice No. **CWE/TN/MS/24/019/24**

Tender No. - 85045919, Item Description- Mild Steel Chequered Plates 6x1250x2500 mm in the Specification IS: 3652: 2009, Pattern 1A, Quantity: 90000 KGS, Due date for opening - 22/07/24, Tender Address - 7221000. Complete details of tender is available at Central Railway official website [www.rpsgw.in](http://www.rpsgw.in) in the complete documents can be downloaded from the website.

SUN 223 By Chief Material Manager (CWE)

visit details at the website or e-mail

For Advertising in  
**TENDER PAGES**  
Contact  
**JITENDRA PATIL**  
Mobile No.: 9029012015  
Landline No.: 67440215

**ARVIND LIMITED**  
CIN: L3719G1933PLC00093  
Regd. Office: Naroda Road, Ahmedabad - 380025  
Website: [www.arvind.com](http://www.arvind.com); Email: [investor@arvind.in](mailto:investor@arvind.in)  
Tel.: +91 79 6828000-8108-09

**NOTICE FOR ATTENTION OF SHAREHOLDERS OF THE COMPANY**

Pursuant to the General Circular No. 09/2023 dated 25th September, 2023 issued by the Ministry of Corporate Affairs (MCA) and SEBI/HO/CFD/PD-2/CIR/2023/167 dated 7th October, 2023/Other Audio Visual Means (VC/OAVM) and related certain provisions related to the Annual Report.

In compliance with the provisions of the Companies Act, 2013 ("Act"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") and MCA Circulars, the forthcoming AGM of the Company will be held on Thursday, 1st August, 2024 at 03:30 P. M. through VC / OAVM to transact the business that will be set forth in the Notice of the meeting. The Registered Office of the Company shall be the deemed venue of the Meeting.

The said Circulars have also allowed the Company to dispense with the requirement of dispatching the physical copies of Notice of the AGM and Annual Report. Accordingly, the same will be sent only in electronic mode to the members whose email addresses are registered with the Registrar and Transfer Agents or with the Depository Participant(s). The Notice of the AGM also contains the instructions relating to e-voting or e-voting through remote e-voting or e-voting during the meeting. The Notice of the AGM and Annual Report will also be made available on the website of the Company at [www.arvind.com](http://www.arvind.com), websites of stock exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) respectively and on the website of NSDL at [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com).

Further, to attend/register the email addresses/bank details, shareholders may follow the instructions mentioned below:

Physical Holding	Visit the link: <a href="https://linkweb.linkintime.co.in/EmailReg/Email_Register.html">https://linkweb.linkintime.co.in/EmailReg/Email_Register.html</a> and follow the registration process as guided therein. The members are requested to provide details such as Name, Folio Number, Certificate number, PAN, mobile number and e-mail address.
Demat Holding	Contact your Depository Participant (DP) and register your email address in your demat account as per the process communicated by your DP

This notice is issued for the information and benefit of the Members of the Company in compliance with the applicable circulars of MCA and SEBI.

By order of the Board  
Arvind  
Company Secretary  
Membership No: 20162

Ahmedabad



[illegible][illegible]

CORRESPONDENCE TO THE DETAILED PUBLIC STATEMENT  
FOR ATTENTION TO THE SHAREHOLDERS OF

**INTEGRA SUTCHIK INC.** LIMITED

(Corporate Identification No. L29130Q1992PLC018684)

Regd. Office: No. 402, Shaheedan Apts, Indira Nagar, Vaynappa, Vadodra, Gujarat-390017.  
Phone: No. +91-265-6833033; Email: [info@integrasutich.com](mailto:info@integrasutich.com); [shareholders@integragmail.com](mailto:shareholders@integragmail.com)

In compliance with Regulations 3(1) and 4 read with Regulations 15 of the SEBI (LOD) Regulations, 2003, the following information is being furnished:

This compliance to the detailed public statement is being issued by Navipoint Corporate Advisors Limited, on behalf of Northvale Capital Partners Private Limited (Acquirer) in compliance with the Securities and Exchange Board of India (SEBI) (Acquisition of Shares and Takeovers) Regulations, 2007 (SAST) Regulations and Regulation 15 of the SEBI Observation Letter No. SEBHO/CIO/REGD-CAC-RAC-CRO/01/2024 dated 21/13 July 2024, read 28/24 in respect of Open Offer<sup>1</sup> for the acquisition up to 10% of the equity share capital of the Target Company. The details of the offer are given below:  
The name of the Target Company: The Detailed Public Statement (DPS) pursuant to the Public Announcement (PA) made by the Acquirers have appeared in Financial Express (English), Business Standard (English), Money (English), Midweek (Marathi)-Mumbai Daily (Mumbai edition) on 20<sup>th</sup> February, 2024.

THE SHAREHOLDERS OF THE TARGET COMPANY ARE REQUESTED TO KINDLY NOTE THAT THE FOLLOWING INFORMATION RELATES TO OFFER:

<sup>1</sup>. Update in the schedule of activities. The original and revised schedule of activities as per

[illegible]



**Arvind**  
FASHION POSITIVE POSSIBILITIES

## અરવિંદ નીપીડેસ

CIN: LT171993/193PL/C000093  
**રજીસ્ટર્ડ સ્ટોર્સ:** નવોરાણા, અમદાવાદ - ૩૮૦૦૧૫  
**વેબસાઇટ:** [www.arvind.com](http://www.arvind.com) **ઇમેઇલ:** [investor@arvind.in](mailto:investor@arvind.in)  
**ફોન:** +૯૧.૭૮.૭૮૬૨.૮૦૦૦-+૮૦૦૦-૫૮૫૮

---

### કંપનીના શેરોહોલ્ડર્સની જાણકારી માટેની નોટીસ

ગોપીકૃષ્ણ અક્લેષ મંથાવલે (‘જોસેસીએ’) દ્વારા જાપાની કાર્બોન જાલન પર સહયુગ્મ નં. ૦૮/૨૦૧૩ નોમીન કરાવેલ, ૨૦૧૩ અને તેની દ્વારા જાપી કરાવેલ SEBI/SEBI/HO/CFDP/CFD-POD-2/P/CFD/223/17 નો તારીખ ૦૫ ઓક્ટોબર, ૨૦૨૩ (એક્ટુઅલ ટાઇ ‘પબ્લિશ’ થી) અનુસાર, કંપનીનાં નામો વિડિસી ડોન-રૂપરૂપ/અનન ઓડિસી રૂપરૂપ/અનન (‘વિડિસી/એસએલએમ’) નોમીન કરવામાં આવેલ છે અને વાલિડ અનુદાન સરતિફિકેશન/એસએલએમની મુદત અંતિમ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ (એસ. ટી.એસ. ડેટ) સુધી (વિડિસી ઓડિસી રૂપરૂપ અનુદાન સરતિફિકેશન/એસએલએમની મુદત અંતિમ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ (સિડિસી રૂપરૂપ/અનન ઓડિસી રૂપરૂપ) નો અનુદાન અનુદાન અને એસએલએમની પબ્લિશીંગ ઓડિસી રૂપરૂપ અનુદાન) પૂરતી, ૨ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ અંતિમ રહેશે ૦૩:૩૦ વાગ્યે સાંજની નોટીસમાં જણાવેલ કસોટી પાસ થઈ વીસી/એસએલએમ માટે અનુદાન રહેશે. કંપનીનાં સંચાલન સુધારા કંપનીનાં રૂપરૂપ રાહતી રહેશે અને મુખ્યમંત્રી.

જણાવેલ પબ્લિશીંગ ઓડિસી રૂપરૂપ અનુદાનની નોટીસ અને વાલિડ અનુદાનની કોપીઓ નવરાણા નોંધકવાળા પાના પરથી જાણી શકાય છે. હાલ સરતિફિકેશન અને સરતિફિકેશન ઇમેઇલ અનુદાન અને ટ્રાન્સપરન્ટ એન્જ અનુદાન વિડિસી રૂપરૂપ/અનન રૂપરૂપ રજીસ્ટર્ડ કાર્ટર ટેબલ નોમીન કરવામાં આવેલ છે અને એસએલએમની નોટીસમાં જણાવેલ થ-નોટીસ અનુસાર અમલ કરવામાં થ-નોટીસના માત્ર સરતિફિકેશન પૂરતાનું અનુદાન રહેશે. એસએલએમની નોટીસમાં અનુદાન અને વાલિડ અનુદાન કંપનીનાં વેબસાઇટ [www.arvind.com](http://www.arvind.com), સરતિફિકેશન અને એસએલએમની વીડિસી રૂપરૂપ અને નવરાણા સરતિફિકેશન એસએલએમ અને એસએલએમની વીડિસી રૂપરૂપ અનુદાન [www.resindia.com](http://www.resindia.com) અને એસએલએમની વીડિસી રૂપરૂપ અનુદાન [www.resindia.com](http://www.resindia.com) પર પાસા ઉપલબ્ધ રહેશે.

**વડાપ્રમુખ કંપની / ડિરેક્ટર/કોર્પોરેટ ઇમેઇલ એડ્રેસ રૂપરૂપ / નોમીનાલ અને વાલિડ અનુદાન સુધારા અનુદાનની અનુમતી રહે છે :**

<b>ડિરેક્ટર/કોર્પોરેટ (અમલકારી) ઇમેઇલ એડ્રેસ સુધારવામાં</b>	<a href="mailto:https://web.inlinkname.com/EmailReg/Email_Register.html">https://web.inlinkname.com/EmailReg/Email_Register.html</a> મિનિમી મુશ્કેલીભાગ લાગે તેમાં સુચનાવેલ સ્ટુડન્ટ/નવરાણા અનુદાન/સુધારા. સંપર્કો નામ, ડોમેઇનનો નંબર, સ્ટીકીડી/કોર્પોરેટ નંબર, નોમીનાલ નંબર, ઇમેઇલ એડ્રેસ વગેરે પાસથી જાણવામાં આવે છે.
<b>ડિરેક્ટર/કોર્પોરેટ</b>	તમારા ડિરેક્ટર/કોર્પોરેટ વીડિસી રૂપરૂપ/અનન (ડી.પી) સંપર્ક ટાઇમ તમારા ડી.પી દ્વારા જાણાવેલ પ્રક્રિયા અનુસરતીને તમારા ડિરેક્ટર એસએલએમ/તમારા ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર કરવાનો

નોટીસના કુશમતી  
**સુધારા**  
**કોર્પોરેટ** સ્ટીકીડી  
**મેઇલ/સુધારા નંબર - ૨૦૧૬૩**